

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન જાહેર કરે છે 2021 ના મુખ્ય કાર્યો જે સિદ્ધિઓને દર્શાવે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (09 ફેબ્રુઆરી 2022) – આજે સીટી ઓફ બ્રમ્પટને 2021માં સિદ્ધ થયેલ 2018-2022 ટર્મ ઓફ કાઉન્સિલ પ્રાધાન્યતાઓ પર એક અપડેટ જારી કર્યો છે જેમાં ગત વર્ષમાં થયેલ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

COVID-19 મહામારીમાંથી માર્ગ કાઢવાનું ચાલુ રાખીને પણ સિટીએ જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેવા ટાણે પણ સિટી વિશ્વવાસપાત્ર અને અસરકારક સેવાઓ બજાવી શક્યા હતા જે રહેવાસીઓ માટે સૌથી અગત્યની હકીકત છે અને સાથે આ ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાધાન્યતાઓને તેઓ આકાર આપી શક્યા છે.

COVID-19 દરમિયાન સમુદાયનો ટેકો

સિટીના ટાસ્ક ફોર્સ અને રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ એ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું જેથી સુનિશ્ચિત કરી શકાય કે સમુદાયમાં COVID-19થી અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ અને સંસાધનો પૂરા પાડી શકાય, અને તેમ કરતા હિમાયતો કરીને મહામારીના પ્રારંભથી અત્યાર સુધી \$120 મિલિયન COVID-સંબંધિત ભંડોળ ભેગું કર્યું હતું.

અનેક મુખ્ય મુદ્દાઓ પૈકી સામેલ છે:

- સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સ સામુદાયિક સંસ્થાઓને સેનિટાઈઝરના 350 થી વધુ બોક્સ અને એન્ટીબેક્ટેરિયલ વાઈપ્સના 200 બોક્સનું સંકલિત વિતરણ કર્યું; અને પીલના અગ્રેસર ખોરાક વિતરકો સાથે ભાગીદારી કરી જેથી પીલ ભૂખ રાહત નેટવર્કનો વિકાસ થઈ શકે.
- સિનિયર્સ સપોર્ટ ટાસ્કફોર્સે બ્રમ્પટન રિક્રિએશન સાથે હાથ મિલાવીને સિનિયર્સ ડિજિટલ કાફેના માધ્યમથી 51 સભાઓ યોજી હતી; અને રિજન ઓફ પીલના કમ્યુનિટી રિસ્પોન્સ ટેબલ સિનિયર્સ પેટા જૂથ તેમજ સામૂહિક રસીકરણ સમિતિ સાથે સહયોગ સાધ્યો હતો.
- યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સે યુવાનોને સક્રિય રહેવા અને મનોરંજન માટે પ્રોત્સાહિત કરવા માટે નિ:શુલ્ક ઈન્ટરેક્ટિવ અને સમાવિષ્ટ સામાજિક મીડિયા પ્રવૃત્તિઓ અને રમતો, તેમજ ફિટનેસ પ્રોગ્રામ્સ અને ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું; અને તેના 40 કરતા વધુ વયના યુવાવર્ગની સેવા કરતી સંસ્થાઓના નેટવર્ક દ્વારા સેવાઓની સુવિધા અને પ્રોત્સાહન આપે છે.
- ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સે ત્રણ નાના બિઝનેસ રાઉન્ડટેબલનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે 60 નાના ઉદ્યોગો હાજર હતા; અને બ્રમ્પટન આંત્રપ્રુન્યોર સેંટર દ્વારા 850 નાના વ્યવસાયોને 78,800 રેપિડ એન્ટિજેન ટેસ્ટ હાથ ધર્યા હતા.
- રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપે બે હિસ્સાધારકોની સભાઓ યોજી હતી જેમાં 55 સમુદાયિક જૂથોને સિટીની સવલતો અને પ્રોગ્રામ્સ સુરક્ષિત રીતે ફરી ખુલ્લા મુકવાના મુદ્દા પર ચર્ચા કરવા પ્રવૃત્ત કર્યા હતા; અને કાર્યકારી જૂથના પ્રમુખે સોશયલ મિડિયા પર એક કરતા વધુ જાહેર બેઠકો બાય-લો એન્ડ એન્ફોર્સમેન્ટ અને પીલ રિજનના આરોગ્યના તબીબી અધિકારી સાથે હાથ ધરી હતી.

બ્રમ્પટન તકોનું શહેર છે

સિટીએ જીવનનિર્વાહ અને સમૃદ્ધિમાં સતત સુધારો લાવ્યો છે.

- કાઉન્સિલ દ્વારા મંજૂર થયેલ સસ્તા આવાસ વ્યુહરચના (Affordable Housing Strategy) માટે \$8.4 મિલિયન ફાળવ્યા.
- નવા ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાનના ભાગરૂપે સ્ટ્રીટસ્કેપિંગના કાર્ય માટે \$16.6 મિલિયનનું રોકાણ કર્યું.
- વેલકમિંગ સ્ટ્રીટ્સ (Welcoming Streets)ના પાયલટ પ્રોગ્રામ માટે રિજન ઓફ પીલ તરફથી \$2,50,000 પ્રાપ્ત કર્યા, જેનો હેતુ સમુદાયોમાં સુરક્ષા સુધારીને ડાઉનટાઉનના સમુદાયોને મદદરૂપ થવાનો છે.
- બ્રમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં 14 સ્ટાર્ટ-અપ્સને સ્વીકારીને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકો માટે બીહાઈવ બ્રમ્પટન (B Hive Brampton)નું લોકાર્પણ કર્યું.

બ્રમ્પટન પરચરંગી છે

શહેર આખામાં વૈવિધ્ય રોપાઈ જાય તે માટેના સાકલ્યવાદી માળખાનો વિકાસ કરીને સિટી, બ્રમ્પટનના વૈવિધ્યને વધાવી રહ્યા છે:

- \$675,238 જેટલી વિતરિત કરવા માટેની માતબર રકમ સાથે એડવાન્સ બ્રમ્પટન ફંડના માધ્યમથી 70 સંસ્થાઓને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું.
- બ્રમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ ખાતે 500 કરતા વધુ લોકો વિવિધ સમુદાયો માટેના કારકિર્દીની માહિતીના સત્રોમાં હાજર રહ્યા.
- માર્કે ફેસ્ટિવલ્સ એન્ડ ઈવેન્ટ્સ ફંડ (Marquee Festival and Events Fund)ના માધ્યમથી 6 કમ્યુનિટી ઓર્ગનાઈઝેશન ઈવેન્ટ્સ માટે \$2,90,775ની રકમ પૂરી પાડી.
- બ્રમ્પટનની આર્ટ્સ કલ્ચર એન્ડ ક્રિએટિવ ડેવેલપમેન્ટ એજન્સીએ વિવિધ અને હાંસિયામાં ધકેલાયેલ જૂથો માટેના સહયોગ, ઈવેન્ટ્સ અને તકોને પ્રાથમિકતા આપી.

બ્રમ્પટન એક ગ્રીન સિટી છે

સિટી ટકાઉક્ષમતા ઊભી કરી રહ્યા છે:

- ઓન્ટારિયોની પ્રથમ નગરપાલિકા બની જેમણે સંપૂર્ણ વિદ્યુત શક્તિથી ચાલતી ફાયર ટ્રક સંપાદિત કરી.
- બ્રમ્પટન ટ્રાન્ઝિટ ફ્લીટમાં આઠ વિદ્યુત બસોને આવકારી.
- બેટ્સમેન પાર્ક વૂડલોટના પુનરુત્થાન માટે CN અને ટ્રી કેનેડા (Tree Canada) પાસેથી \$25,000નું અનુદાન મેળવ્યું.
- 8,000 જેટલા વૃક્ષો વાવવા માટે કેનેડાની સરકાર પાસેથી \$1.2 મિલિયનની રકમ મેળવી શક્યા.

બ્રમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે

સમાજની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું, માનસિક આરોગ્ય સહાયમાં સુધારા લાવવા અને સક્રિય તથા નિરોગી જીવનશૈલીઓને પ્રોત્સાહિત કરવી:

- જેઝ કેર ફાઉન્ડેશન અને પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ સાથે હાથ મિલાવીને જુડીથ નાયમેન ફિલ્ડ ઓફ ટ્રીમ્સનું સુગમ બેઝબોલ ડાયમંડ પૂર્ણ કરવામાં આવ્યું.
- તમામ વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષિત માર્ગો માટે 50 નવા ઓટોમેટેડ સ્પીડ એન્ફોર્સમેન્ટ કેમેરા શહેરમાં ગોઠવાયા (ઓન્ટારિયોમાં સૌથી વિશાળ ASE પ્રોગ્રામ)
- આખા શહેરમાં 180 કમ્યુનિટી સેફ્ટી ઝોન્સ રચાયા જેથી માર્ગ વ્યવહાર સલામત રહે.
- બ્રમ્પટન એનિમલ સર્વિસિસે કેનેડામાં સહુ પ્રથમ વખત હોમ ટુ હોમ (Home To Home™)ની સ્જૂઆત કરી જે પાળેલા પ્રાણીઓ માટે નવું ઘર શોધવાની એક સેવા છે જેમના પ્રયાસોથી 103 પ્રાણીઓને નવું ઘર પ્રાપ્ત થયું

બ્રમ્પટન એક સુશાસિત શહેર છે

બ્રમ્પટન તેમના રોજિંદા પ્રચાલનોમાં સુધારા લાવી રહ્યા છે:

- સતત 6ઠ્ઠા વર્ષે S&P ટ્રિપલ A ક્રેડિટ રેટિંગ જાળવી રાખ્યું જે સિટીનુઆ મજબૂત અર્થતંત્ર અને વિત્તીય વ્યવસ્થાપનની પ્રણાલિના દર્શન કરાવે છે.
- કેનેડાના ઉત્તમ સમુદાયો 2021ના #13 તરીકે મેકલિન્સ લિસ્ટમાં વરણી
- ફોર્સ કેનેડાના ઉત્તમ નિયોક્તા 2021 તરીકે આંકવામાં આવ્યા
- 10,463 રહેણાંક પરમિટ અને 1,145 ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય પરમિટ જારી કરી, જેનું મૂલ્ય કુલ \$1.726 બિલિયન હતું
- રિઝર્વમાં \$117 બિલિયનનો વિક્રમી ફાળો જાળવી રાખીને નવા પીલ મેમોરિયલ હોસ્પિટલ માટે \$62.5 બિલિયનનું ભંડોળ નિયુક્ત કરીને આરોગ્યસંભાળના વિસ્તરણ માટે શહેરની પ્રતિબદ્ધતા દર્શાવીને સતત ચોથી વખત ટેક્સ ફીઝ પ્રદાન કરી શક્યા

2021ના મુદ્દાઓ અને સિદ્ધિઓ વિશે વધુ માહિતી માટે મુલાકાત લો www.brampton.ca/tocp.

સુવાક્યો

"અમારા કાબૂ બહારના પડકારો વચ્ચે પણ સિટીએ સમસ્ત 2021ની સાલમાં અમારી અગત્યની પ્રાથમિકતાઓમાં નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી હતી. અમે અમારા રહેવાસીઓ અને વ્યવસાયો માટે સુપરિણામો મેળવવાનું ચાલુ રાખ્યું જેમકે સંપૂર્ણપણે વિદ્યુત ફાયર ટ્રક મેળવીને પર્યાવરણીય ટકાઉક્ષમતામાં આપણે અગ્રણી હોવાનું પ્રસ્થાપિત કરતા રહેવું કે આપણા ડાઉનટાઉનના સ્ટ્રીટસ્કેપિંગ માટે \$16.6 બિલિયનના રોકાનને મંજૂરી આપવી, ચોથી વખત સતત વેરા સ્તરો સ્થિર રાખવા જેને ટેક્સ ફીઝ પણ કહેવાય છે અને સાથે અનામત ભંડોળમાં વિક્રમી યોગદાન આપવું તેમજ સિટીની આરોગ્ય સંભાળના વિસ્તરણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવી. અમે આ કાર્ય 2022માં ચાલુ રાખવા આતુર છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“2021માં અમે COVID-19ની મહામારીમાંથી માર્ગ કાઢતા હતાં તે દરમિયાન સંખ્યાબંધ પડકારોનો સામનો કર્યો પરંતુ અમારા કર્મચારીઓ ઝડપથી સમાયોજીત થયા જેથી રહેવાસીઓ, વ્યવસાયો અને સમુદાયોને મદદરૂપ થવું ચાલુ રાખી શકાય. ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓને આગળ વધારવા પર તીવ્ર ફોકસ સાથે અમે મહત્વની પહેલોને આગળ ધપાવતા રહ્યા અને આપણા શહેરનો વિકાસ કરતા રહ્યા. 2021માં અમારી ટીમે કરેલી પ્રગતિનું મને ગૌરવ છે, જ્યારે આ સમગ્ર સમય દરમિયાન આપણા રહેવાસીઓ માટે સૌથી અગત્યની હોય એવી કાર્યક્ષમ અને અસરકારક સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે.

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સિટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca